

## કે. વી. કે, દેવાતજ દ્વારા બેચરી ગામે ફળ, ફુલ તથા શાકભાજી ઉત્પાદન,

### મુલ્યવર્ધન: પ્રદર્શન - વ- હરીફાઇ યોજાઇ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજ દ્વારા તા. ૧૮/૦૩/૨૦૧૬ ના રોજ બેચરી ગામ ખાતે ફળ, ફુલ તથા શાકભાજી ઉત્પાદન, મુલ્યવર્ધન: પ્રદર્શન - વ- હરીફાઇનું આયોજન કરવામાં આવેલ જેમાં ૧૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધેલ તેમાંથી ૮૨ ખેડૂતોએ તેમના નમુનાઓ સાથે હરીફાઇમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી બી. યુ. પરમાર, સંયુક્ત બાગાયત નિયામકશ્રી, ડૉ. એન, વી. સોની, સહ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી, વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, આ. ફ. યુ., આણંદ તેમજ ડૉ. નીતીનભાઈ શાહ, પ્રાધ્યાપક અને વડાશ્રી, બાગાયત વિભાગ, આ. ફ. યુ., આણંદ અને ડૉ. આર. આર. આચાર્ય, વડાશ્રી, મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આ. ફ. યુ., આણંદ અને શ્રી. પી. એન. શુક્લા, નાયબ બાગાયત નિયામકશ્રી, આણંદ તથા ડૉ. જી. જી. પટેલ, પ્રોગ્રામ કોઓર્ડિનેટર, કેવીકે, દેવાતજ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. જી. જી. પટેલે મહાનુભાવો તેમજ ખેડૂતોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું ત્યારબાદ કેવીકે દ્વારા તૈયાર કરેલ ત્રણ ફોલ્ડર (૧) આમળાની વિવિધ બનાવટો (૨) ટામેટાની વિવિધ બનાવટો (૩) કેરીની મુલ્યવર્ધિત બનાવટો, નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ શ્રી બી. યુ. પરમાર સાહેબે જીલ્લામાં થતા બાગાયતી પાકો તથા તેની આગામી સમયમાં જરૂરીયાત બાબતે પ્રવચન આપ્યું હતું. ડૉ. નીતીનભાઈ શાહ દ્વારા બાગાયતી પાકોનું મુલ્યવર્ધન અને તેના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. શ્રી. પી. એન. શુક્લા સાહેબે બાગાયતી પાકોમાં સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતી આપી હતી. ડૉ. એન, વી. સોની સાહેબે વિસ્તરણ શિક્ષણની પ્રવૃત્તિઓ તથા કૃષિ સંલગ્ન પ્રકાશનો વિશે માહિતી આપી હતી ત્યારબાદ ડૉ. આર. આર. આચાર્ય સાહેબે શાકભાજીના બિયારણ તેમજ નવી જાતો અને તેની ખેત પધ્ધતિઓ વિષય પર માહિતી આપી હતી. જમીનની ઉત્પાદકતાની જાળવણી તથા શાકભાજીની સજીવ ખેતી વિશે ડૉ. જી. જી. પટેલ સાહેબે માહિતી આપી હતી તથા શ્રીમતી અમીતા પરમાર વિ.નિ. (બાગાયત) કિચન ગાર્ડનીંગ વિશે માહિતી આપી હતી.

નિર્ણાયકો દ્વારા પ્રદર્શનમાં મુકેલા નમુનાઓનું મુલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ નંબર જાહેર કરી વિજેતાઓને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન તેમજ સંચાલન શ્રીમતી અમીતાબેન પરમારે વિ.નિ. (બાગાયત) કરેલ હતું. જેમાં કેન્દ્રના શ્રી. વાચ. સી. લકુમ વિ. નિ. (એગ્રોનોમી), શ્રી. જે. એચ. ભટ્ટ વિ. નિ. (ફીશરીઝ), શ્રીમતી અંજલી જાદવ (પ્રો. આસી. ગૃહ વિજ્ઞાન) અને બાગાયત ખાતામાંથી શ્રી. નિલેશ પી. પટેલ (બાગાયત અધીકારી) અને આત્માના બીટીએમ શ્રી.સીરેશ મહેરીયા; આ સર્વેએ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરેલ હતી. આ કાર્યક્રમના અંતે શ્રી જૈમીન ભટ્ટ, વિ.નિ. (ફીશરીઝ) સર્વેનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરી હતી.



કાર્યક્રમનું ઉદઘાટન અને મહાનુભાવોનું સ્વાગત



મુલ્યવર્ધન વિષયક માહિતી ફોલ્ડરનું વિમોચન



પ્રદર્શનની મુલાકાત



વિષય નિષ્ણાંતો દ્વારા તાંત્રીક માહિતી



નિર્ણાયકો દ્વારા હરીફાઈનું મુલ્યાંકન



વિજેતાઓને પ્રમાણપત્રનું વિતરણ